

# APTAIN PIPES L'

Regd. Office & Works: Survey No. 257, Plot No. 23 to 28, N.H. No. 27, SHAPAR (Veraval) Dist. Rajkot (Gujarat) INDIA. Mobile: +91 99090 29066, Toll Free Number: 1800 212 5626 website : www.captainpipes.com | e-mail : info@captainpipes.com

CIN.: L25191GJ2010PLC059094

DATE: 18/07/2024

To,

The Bombay Stock Exchange (BSE Limited) Phiroze Jeejeebhoy Towers **Dalal Street** Mumbai- 400001

Dear Sir / Madam,

### **Sub: NEWSPAPER PULICATION OF BOARD MEETING NOTICE**

Pursuant to the requirement of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, attached herewith newspaper publication of board meeting notice given in Financial Express Newspaper One Vernacular Language(Gujarati ) dated 18/07/2024 And Other Nationwide Circulating English Newspaper dated 18/07/2024.

Kindly take note of the above.

Thanking you,

Yours faithfully,

FOR, CAPTAIN PIPES LIMITED



**KANTILAL M. GEDIA** (WHOLETIME DIRECTOR)

DIN: 00127949

choose substance over sensation.

For the Indian Intelligent. The Indian Express.

### TENNECO FEDERAL-MOGUL GOETZE (INDIA) LIMITED

### NOTICE

construent receivements annual reports him websites of the stock exchanges (NSE & BSE) and on the NSDL's website at https://www.exoting.nsdl.com.

Situatividiars will have an opportunity to cast their vote remotely on Strantolders will have an opportunity to cast their vote remotely on Strantolders will have an opportunity to cast their vote remotely on the strantolders with other of ACM through electronic voting system. The manner of voting remotely for shareholders vibroling shares in denaterialized mode, physical mode and for shareholders will be not have not registered their email addressess will be a made available to on the website of the Company, Shareholders are requested to visit the website for such defails. The Notice of 87 ACM of the Company will be sent to the shareholders in accordance with the applicable laws on their email addresses shortly.

### TASTY BITE

TASTY BITE EATABLES LIMITED

Regd Off: 201-202. Mayfair Towers. Wakdewadi, Shivajinagar

Pune – 411 005 Tel: 020 3021 6000; Fax: 020 3021 6048;

CIV. 154199P1495EPL.037374

Website: www.tastybite.co.in; e-mail: info@tastybite.com

Fune — 411 005 Tel CO 2021 6000, Face 1003 3021 8948.
Welstein CON. LESH 9970 18896-L0027347.
Welstein CON. LESH 9970 18896-L0027347.
NOTICE OF 4011 ANNUAL GENERAL MEETING AND
NOTICE OF 4011 ANNUAL MEETING AND
NOTICE OF 4011 ANNUAL MEETING AND
NOTICE OF 4011 ANNUAL MEETING
NO

lovelding Folio No., name of shareholder. Scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), ADHAR (self-attested scanned copy of Adahra Card) for registering and address. Scanned copy of Adahra Card) for registering and address. The scanned copy of Adahra (PA) and register your email address and bank account details in your demat account, as per the process advised by your IDP.

The received and the process advised by your local control of the process advised by your local extension of the process advised by your local extension of the process and th

For Tasty Bite Eatables Limited Vimal Tank Company Secretary Membership No. : A22370

lation:
AMC services for Firefighting system (Ref.: MTPS25AD771)
Service for operation of RO plant (Ref.: MTPS25AD772)
Replacement of Service water piped. WITE PS25AD772
Replacement of Service water piped. WITE PS25AD772
Supply of Sparse for Soot Blower system (HRSB & LRSB) (Ref.: 1500016185)
Supply of Sparse for Soot Blower system (HRSB & LRSB) (Ref.: 1500016185)
Percyalification unguirements, kender fee, bid security 6xc, please visit fiender se For prequalification requirements, tender fee, bit security etc., please visit Tender section of our website (URL: https://www.tatapower.com/bender/tender/ista.apx) an refer detailed Tender Notice for subject tender. Eligible bidders willing to participate it with stender may submit their Expression of Interest along with the Tender Fee later by 95/90/2024.

CreditAccess®

### CREDITACCESS GRAMEEN LIMITED

No. 49, 46th Cross, 8th Block, Jayanagar, Bengaluru - 560070 Tel: +91 80 22637300 | Fax: +91 80 26643433 Email: cs@cagrameen.in; Website: www.croditaccessgrameen.in CIN: L51216KA1991PLC053425

# NOTICE OF THE 33<sup>rd</sup> ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 33" Annual General Meeting (AGM) of the members of CreditAccess Grameel Limited the "Company") will be held on Monday, August 12, 2024 at 11:00 a.m. (IST) through Vedeo Confessional Joliner Audio-Vesual Meem Vol. (1) through Vedeo Confessional Joliner Audio-Vesual Meem Vol. (1) through Vedeo Confessional Joliner Audio-Vesual Meem Vol. (1) through Vol. (2) through Vedeo Confessional Joliner 14,2020, 17,2020, 20/2020 02/2021, 22/2022, 10/2020 and 09/2023 issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular No. SEBJIH/IO/CPD/PD-D2/PICII/2023/14 of SEBJIH/IO/CPD/PD-D2-PICII/2023/14 issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular No. SEBJIH/IO/CPD/PD-D2-PICII/2023/14 issued by the Volume of SebJIH/IO/CPD/PD-D2-PICII/2023/14 in SebJIH/IO/

05, 2024.

In compliance with the Circulars, electronic copies of the Notice of the AGM daied July.

In compliance with the Circulars, electronic copies of the Notice of the AGM and Annual Report for 2023-24 have been sent to all the members whose email IDs are registered with the Company! Depository Participants/Registers & Share Transfer Agent. These documents are also available on the website of the Company at www.creditaccessgrameen.in, Stock Exchange websites www.bsieridia.com and www.nseindia.com and on the website of KFIn Technologies Limited (KFInlers), the Company's Registrar & Share Transfer Agents (RTA) at https://evoting.kihrlench.com/. The dispatch of Notice of the AGM through emails has been completed on July 17, 2024.

2024. Members holding shares in physical form or dematerialized form, as on the out-off date August 05, 2024, may cast their votes electronically on the businesses as set forth in the Notice of the AGM through the electronic voting system of RTA (remote e-voting). Members are herby informed that:

i) The businesses as set forth in the Notice of the AGM may be transacted through remote e-voting or e-voting system at the AGM.

- Record date for the purpose of Dividend is fixed as Friday, July 26, 2024;
- inclusive); Dividend, if declared, will be paid on Friday, August 23, 2024; The cut-off date for determining the eligibility to vote by remote e-voting or by e-voting system at the AGM shall be Monday, August 05, 2024;

- the AGM. Any person, who acquires shares of the Company and becomes imember post dispatch of the Notice of the AGM and holds share as on the cut off date it. Monday, August 55, 2024, may obtain the login ID and password by sending a request a elementar-fixed inflictation. However, if a member is already registered with RTA for e-voting then the existing user ID and password can be used for casting helf vote.
- einward.n/@gkintech.com. However, if a member is already registered with RTA for e-voting them the existing user ID and password can be used for easiing their vote.

  Members may note that all once the votes of lower for change it subsequently; i.b. The facility for e-voting will also be made suitable during the AGM, and those members present in the AGM through VC facility, who have not cast their vote on the resolution strongly member who have as their votes on the resolution strongly member e-voting and are otherwise nor barred from doing so, shall be eligible to vote through the e-voting system at the AGM. It he members who have as their votes by remote e-voting prior to the AGM may attend the AGM but shall not be entitled to cast their votes says members holding shares in ormaterialized cast their votes and may also the control of the AGM may attend the AGM but shall not be entitled to cast their votes and members holding shares in demandabilized mode and for members who have as their votes by remote e-voting prior to the AGM may attend the AGM but shall constitute the admitted shares and the AGM of the members who have not registered demandabilized mode and for members who have not registered their email address and in consequence the Annual Report. Notice of AGM could not be serviced, may temporarily get their email address and mobile consequence the Annual Report. Notice of AGM could not be serviced, may temporarily get their email address and mobile consequence that challed by sending form no. ISR1 and address and contact details by sending form no. ISR1 and address and contact details by sending form no. ISR1 and address and contact details by sending form no. ISR1 and address and contact details by sending form no. ISR1 and address and contact details by sending form no. ISR1 and address and contact details by sending form no. ISR1 and address and contact details by sending form no. ISR1 and address and contact details by developed period periodicipants or with the Company send, and remail registration

- Manager of KFrintech attoll free no. 1800 345-4001.

  Atternatively, members may send en e-mail requestat the email id-einward.ris@kfritech.com along with a scanned copy of the signed request later providing the email address, noble number, self-attested PAN copy and Client Master copy for sending the Annual report, Notice of AGM along with remote e-voting instructions.

  for CreditAccess Grameen Limited

Place: Bengaluru M. J. Mahadev Prakash Date: July 17, 2024 Company Secretary & Chief Compliance Officer

# captain)

APTAIN PIPES LTD

### NOTICE

Pursuant to regulation 29 of the SEBI LODR Regulations 2015 Notice is hereby given that the meeting of board of directors of the company will be held or Wednesday, 24th JULY, 2024.

To consider and approve the unaudited financial results for the quarter and the year ended on 30 th June, 2024.

The said notice can be accessed The said notice can be accessed on the website of the company at www.captainpipes.com and may also be accessed on the stock exchange website at www.bseindia.com.

Place: Rajkot
Date: 16/07/2024

For, Captain Pipes Lto

sd/ Gopal Khichadia (Managing Director)

### Mindteck,

Mindteck (India) Limited (CIN: L30007KA1991PLC039702) rd Office: A.M.R. Tech Park, Block 1, 3rd Floor, #664, 23/24, ssur Main Road, Bommanahalli, Bengaluru - 560 068

# NOTICE Transfer of Equity Shares in favour of estor Education and Protection Fund (IEPF) Authority

Notice is hereby published pursuent to the provisions of Section 124(6) of the Companies Act, 2013, the Act pred with investor Education and Protection from Authority (Accounting, Andit, Transfer and Refund) elles, 2016 (files) as amended from time to time, that the Equily Shares of the Company in respect of which devided amounts have remained unpaid-infamed for sever (f) crises/cultive year or more as required to be transferred to investor Education and Protection Fundament (IEEF).

(IEEF), in complaince with the Rules, the Company has sent individual notices to all the concerned shareholders, whose shees are liable to be transferred to IEFF, the divideals of such shareholders together with the Folio No, ID-Folio Till or made available on the Company's wideble www.mindeek.com/investors. In his connection, place note the folioping.

4. For shares held in physical form: Duplicate share conflicate(s) shall be issued and bransferred to IEFF. the original state conflicate(s) shall be issued in those shareholders name and held by them, shall automatically stand cancelled.

Ill these enterconnection.

15. For shares held in electronic form: Those shareholders demat account shall be debated for the shares held for transfer to EFF.

These concerned shareholders are requested to first early a valid claim for their controlled controlled to the shares held to first early a valid claim for their controlled controlled to the shareholders are requested to first early entry to the part (FIX), as soon as controlled controlled to the shareholders and the shareholders are the shareholders as the shareholders and the shareholders are claim from the shareholders can claim from the shareholders can claim from the the shareholders can claim from the shareholders and policiation in the personnel and sending the policiation policy from the shareholders are claim from the shareholders and sending the policial copy of the requisite documents anumented in the Form EEF-5, to the Nobal Officer of the Common, Plassa do not that not claim shall expansible Company in respect of



VIMTA LABS LIMITED
CIN: 124 110TG1990PLD0 11977
CIN: 124 110TG1990PLD0 11977
Registered (diffice: 142, IDA Phase III, Cherlapally, Hyderabad — 500051, India
Telle - +91 4027284141; Fax: — 91 4027283857
EMail: shares@vimta.com, Widest: www.vimta.com

Statement of Unaudited Consolidated Financial Results for the Quarter Ended June 30, 2024 Quarter Ended Year Ended 1 Total Income from Operations 165.23 162.84 163.03 544.81 544.81 165.23 162.84 123.51 122.74 121.36 407.76 44.34 44.34 44.28 44.34 7 Reserves (excluding Revaluation Reserve) as shown in Audited Balance Sheet of the previous year 8 Earnings Per Share (of Rs.2/- each) (for continuing and discontinued Operations) 3,152.62

- Notes:
  If he allow is an extinct of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SSERI (Lister), Whigathern and Dischause Regulations (1994) and the Company's Welderlaw (Investigation and Dischause Augustian (Investigation and Dischause are available on the Company's Welderlaw (Investigation and Investigation and Company's Welderlaw count of the National Results are available on the Company's Welderlaw count of the National Results are available on the Company's Welderlaw count of the National Results are available from the Company's Welderlaw (Investigation and Investigation and Investigation and Investigation and Investigation and Investigation and Investigation August (Investigation August (Inv

Vimta

Place : Hyderabad, India Date : July 17, 2024

Place : Hyderabad, India Date : July 17, 2024

VIMTA LABS LIMITED
CIN: L24110TG1930PL0011977
Registered Office: 142, ItaA Phase II, Chertapally, Hydenahad – 500051, India Tele + 39 14027264116; Fax: —91 4027263557
E-Mail: shares@wiinta.com, Website: www.vinnta.com

(Amount in INR millions, except Earnings Per Share						
		Quarter Ended			Year Ended	
S.No.	Particulars	30 Jun 24 (Unaudited)	31 Mar 24 (Audited)	30 Jun 23 (Unaudited)	31 Mar 24 (Audited)	
1	Total Income from Operations	801.99	783.38	821.93	3,128.91	
2	Net Profit / (Less) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	156.67	155.51	155.39	515.37	
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	156.67	155.51	155.39	515.37	
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	116.39	118.01	116.28	388.07	
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)	116.33	115.88	116.22	385.76	
6	Equity Share Capital	44.34	44.34	44.28	44.34	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year				3,118.57	
8	Earnings Per Share (of Rs.2/- each) (for continuing and discontinued Operations)					
	1. Basic (INR)	5.25	5.34	5.25	17.52	
$\neg$	2. Dilluted (INR)	5,18	5,26	5.15	17.26	

Notes:
The above is an extract of the detailed format of Danstarly Financial Results fleet with the Stock Exchanges under Regulation 33 of the SSER (Listing Obligations and Disclosure Requirements) Rigidations, 2015. The full format of the Financial Results are available on the Company's Webber lower within actival part of the Company's Webber lower within actival part Sacked Exchange of hald be unlined (owner-shortda actival). Sacked Results of the State (owner-shortda actival). The above insulated that statistication femalist central for the quarter orded June 30, 2024 have been reviewed and recommended by

indianexpress.com

The Indian Express. For the Indian Intelligent.



I look at every side before taking a side.

Inform your opinion with insightful observations.



-JOURNALISM OF COURAGE

Ahmedabad Ahmedabad

### એ ક્રિકાઓ ક્રિકાર્ગફાયલ કાર્યાત્ર કારાયા કરા હાયુકા ક્રોટેડ

ભૌત્તિક કળજા નોટીસ નિયમ ૮(૧) (સ્થાવર મિલકત માટે) તલવાનું કે એકસમાર હાર્લિકેન્ડ ફાલનાન્સ લીમીટે, કરવ, હેસાએમ લોકા કોમ્પલેસ, શારવી સર્કલ પાસ, ઘાટનું - નાકળન પ્રત ફાલક્રીકાર્કિએ લિકામીટિકાશોગલ અને લિકાન્ટફળના એક કાલમાનિસ્સલ એક્ટ્રેસ અને એન્ક્રોનીસ્ટ એક ક્રિક્સોરિટી લાન્ટેસ્ટ એક્ટ કોર્ટિટી લાન્ટેસ્ટ (એક્ટ્રોલ) માને આ લિસા 3 સાર્ચ લેસાં કહ્યા પર (૧) ફેડ લાગ્ય સત્તાનો હિમારે એક કોર્ટિટી લાન્ટેસ્ટ (એક્ટ્રોલ) માના લિસા 3 સાર્ચ લેસાં કહ્યા પર (૧) ફેડ લાગ્ય સત્તાનો હિમારે અને પ્રાથમિક કોર્ટિટ એક્ટ્રોલ) માના સત્તાનો હિમારે અને પ્રાથમિક કોર્ટિટ એક્ટ્રેલ (એક એક્ટ્રોલ) માને કોર્ટિટ એક્ટ્રેલ (એક એક્ટ્રાલ) માના કોર્ટિટ એક્ટ્રેલ (એક એક્ટ્રોલ) માને કોર્ટિટ એક્ટ્રેલ (એક્ટ્રોલ) માને કોર્ટિટ એક્ટ્રિટ એક્ટ્ર એક્ટ્રિટ એક્ટ્ર એક્ટ્ર એક્ટ્રિટ એક્ટ્ર એક્ટ્રિટ એક્ટ્રિટ એક્ટ્ર એક્ટ્ર એક્ટ્રિટ એક્ટ્ર એક્ટ્ર એક્ટ્ર એક્ટ્ર એક્ટ્ર એક્ટ્ર એક્ટ્રિટ એક્ટ્ર એક્ટ્ર

જામીનદારોનું ધ્યાન દોરવામાં આવે છે.	ોનદારોનું ધ્યાન દોરવામાં આવે છે.				
લોન એકાઉન્ટ નંબર (લોન)/	૧) માંગણા નોટીસની તારીખ	સ્થાવર મિલકતની			

	દેવાદાર/ સહ–દેવાદાર/ જામીનદાર	ર) ભૌતિક કબજાની તારીખ 3) માંગણા નોટીસ મુજબ દાવાની સ્ક્રમ	વિગત		
q	HLR90000000077! શ્રી ભગવાની જાણ કર્યું હતી કરિતાલ પટેલના પુત્ર પરેલા પૂર (દેવાદા: ) શ્રી વિશ્વસુધ્યાર ભગવાની ભાગ પટેલ ને શ્રી ભગવાની ભાગ પટેલા પૂર (લ. – દેવાદા: –) શ્રી હતા	વ. માંગણા નોટીસની તારીખ: ૦૯–૦૫-૧૦૨૩ ૧. ભીતિક હરજાની તારીખ: ૧૩–૦૦-૧૦૨૪ ૩. માંગણા નોટીસ મુજબ દાવાની ૨૭મ: શુ. ૧૩,૧૯,૨૩૦/– (સૃપિયા તેર લાખ ઓપણીસ લ્લેજન નવારો ત્રીસ પૂર) ૦૯–૦૫-૨૦૨૩ મુજબ વાત ૧૦–૦૫- ૧૦૨૩ થી લાગુ ૧૩૬૦ ત્યાજ, આદભિક ખર્ચ, કોસ્ટ, સાર્જ વગેરે.	શ્રી ભાગવતીભાઇ પટેલ જે શ્રી રતિવાલ પટેલામાં પુગલા બામે સ્ટેલ હાઉસ નાં, વપ્ટ-ડી, હિંમત ફળીલા ગામ- મુલાદ, તાલુકો ઓલાડા, કિંતો સુરત (ગુજરાત) ખાતેની જ્યોનન તમામ ભાગ અને હિસ્સા, લેમફબ વહ્યપાન્ટ લોક્સ, સુર્વુસીમા : પૂર્વ રોડ, પશ્ચિમ: રોડ, ઉત્તર : ઘર દક્ષિપા : ઘર		
	સ્થળ : ઉદેપુર સહી/– અધિકૃત અધિકારી તારીખ : ૧૮-૦૩-૨૦૨૪ એસઆજા કાઉસિંગ કાર્યનાન્સ લીમીટેડ				

# સ્વતંત્ર માઇક્રો હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડ 🎷

## માંગણા નોટીસ

ા<u>ાગણા ભારતના</u> સિક્સોરીટાઇપ્રેશન અને રીકસ્ટ્રક્શન ઓફ સારનાહિસ્સાલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્સોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૧) હેઠળ નોટીસ આચી નોટીસ આપવામાં આવે છે કે નીચેના દેવાદા/સે જેમણે સ્વતંત્ર માઇક્રો હાઉલેંગ ફાચનાન્ય કોર્યોટેશન લીમીટે: ળતા ગાતાના આપતાના ભાગ છે જ ભાગા દેવાદાટાનું જમતા ત્યાર માછશ લાકારના સાંભળ વાસ્તરના સાંભળને પ્રોક્ષસમાઓસએફસી) પાસેથી લીભે મેતાને છે તેઓ એસએએએએકસેનીને તેમના લોભના એકવાદીડ માને ભાગેલ્લોનો સ્વાધ ભાગેલી પ્ (છએમઆઇએસ) યુકવવામાં ભિન્ફળ ગચા હતા. દેવાદાર(રો)એ એસએમએસએફસનીને સ્થાવર મિલકત/તોની લિન્ક્યોરીટી યુર્દે પાડેલ છે, તેની વિગતો નીચે આપેલ છે. લોનની વિગતો અને બાકી ટક્મ તેમજ એસએમએસએફસીને અંતિમ તારીખ મુજબ ચુકવવાપાગ ૨૬મ પણ અર્લી નીચે જ્લાલેલ છે. દેવાદાર(રો) તેમજ જાહેર જન્નતાને આથી જાણ કરવામાં આવે છે કે એસએમએસએફસી, સિક્સોર્ડ લેણદારના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્સોરીટાઇઝેલન અને રીકન્સ્ટ્રકલન ઓફ ફાયનાબ્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્સોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (સરફેસી એક્ટ) ની જોગલાઇઓ હેઠળ નીસેના દેવાદાર(રો) સામે કાર્યવાહી શરૂ કરી છે. જો નીસેના દેવાદાર(રો) આ નોટીસના ૬૦ (સાંહીઠ) દિવસની અંદર તેમના ના સામે દર્શાવેલ બાકી રકમ પરત ચુકવવામાં નિષ્ફળ જો તો, નીચે સહી કરનાર સરફેંસી એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠ્ડ સિક્ચોર્ડ લેણદારને પ્રાપ્ત એક અથવા વધુ સત્તાનો ઉપયોગ કરશે, જેમાં મિલકત/તોનો કબજો લેવા તેમજ તેના વેચાણની સત્તાનો

हेवाहार(शे)/	માંગણા લોટીસલી	સિલ્લોર્ડ એસેટ(ટો)
જામીનદાર(રો) નું નામ	તારીખ અને ૨૬મ	(સ્થાવર મિલકત/તો)ની વિગત
લોન કોડ : APP-024-772	8505-60-08	ફ્લેટ નં. બી-૬૦૩, બી, આરએમસી-એમએમછુવાય ફેઝ-૧-ટીપી ૨૪-એફ્પ
શ્રી નિલેષ મુંધાવા	l	૧૫એ, સેન્ટુલ ઝોન-૨, વોર્ડ 3, ટીપી ૨૪, એકપી ૧૫/એ, પોપટપરા મેઇન રોડ
શ્રીમતી ભાવનાબેન મુંધાવા	રૂા. ૨૮૧૫૭૨/-	રાજકોટ, ગુજરાત-૩૬૦૦૦૧
લોન કોડ : APP-026-357	8505-60-05	કલેટ નં. ૭૦૧, ઇ-, આત્રે એલીગન્સ સબપ્લોટ નં. (૨૭+૨૮+૨૯) ૧ અ
શ્રીમતી પ્રેમ દેવી	40-00-6068	ર, રેવન્થુ સર્વે નં. ૨૩૧+૨૩૨+૨૩૩, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. છ
		ફાઇનલ પ્લોટ નં. ૨૭૧૨૮+૨૯, શ્રીનાથ એસ્ટેટ પાસે, સાંઇ- એસ્ટેટ-
શ્રી નારાચણલાલ ખાતિક	રૂા. ૫૫૬૬૨૯/-	પછી, રાનાસન રેલવે કોસિંગ, નરોડા જીઆઇડીસી પાસે, એસ.પી. રીં
		રોડ, મુઠિયા, નરોડા, અમદાવાદ– ગુજરાત–૩૮૨૩૩૦.
લોન કોડ : APP-035-749	40-00-5058	
શ્રી વિશાલકુમાર વિશ્વકર્મા	40-03-6069	ફલેટ નં. ૬૦૨, એ, પારીજાત વિશ્વાસ રેવન્યુ સર્વે નં. ૧૬૬, ટીપી નં. ૧૨
શ્રીમતી સરલાબેન વિશ્વકર્મા		(વટવા–અસલાલી), એસ.પી. રિંગ રોડ, ન્યુ વટવા, અમદાવાદ
શ્રીમતા સરલાળના વજાકમા શ્રી રામનાથ વિશ્વકર્મા	३१. १९६४६६४/-	ગુજરાત-૩૮૨૪૪૦
લોન કોડ : APP-052-910	40-09-5058	ફ્લેટ નં.૪૦૪, ઇ-બ્લોક નં. ૧૬૧૦/એ ડાફ્ટ ટીપીએસ નં. ૪૨૦, સીભાગ્ય હોટ
શ્રીમતી મુક્ષિદેવી સિંઘ	I — —	પાસે, રિંગ રોડ, અસલાલી સર્કલ પાસે, અસલાલી, અમદાવાદ-૩૮૨૪૨
શ્રી કૌશલકુમાર સિંઘ	31. ₹୬ <b>୬୬</b> ୯२/−	
લોન કોડ : APP-023-801	05-05-5058	કલેટ નં. ૫૦૭, સી, સોના આકૃતિ-બી, સર્વે નં. ૨૭૯, સોના આકૃતિ, પ્રમુખ પા
શ્રીમતી મોનાબેન પંચાલ		સામે, ગેરતપુર, તાલુકો–દસ્ક્રોઇ, જિલો–અમદાવાદ–૩૮૨૪૩૫
શ્રી પંકજ મિસ્ત્રી	३।. ६७९८७५/-	
શ્રીમતી કોકિલાબેન મિસ્ત્રી	1	
લોન કોડ : APP-024-862	05-05-5058	ફ્લેટ નં. ઇડબલ્યુએસ ૨૪-૦૦૭-૦૩-૦૩૯૫, ૭, એએમસી-ઇડબલ્યુએસ ૨
શ્રીમતી પિકીબેન પટણી	1	ફેઝ-૩, ટીપી-૧૧૦-નિકોલ-એફપી-૧૦૮ ટીપી ૧૧૦, એફપી ૧૦૮, ગોર્વદા
શ્રી મુકેશભાઇ પટાશી	31. 386408/-	ટેનામેન્ટની આગળ, ચરા પ્લેટિના પાછળ, હરિદર્શન ક્રોસ રોડ પાસે, નિકોલ
30	4 30C 404/-	SHEIGHE-300063
લોન કોડ : APP-037-907	05-05-5058	કલેટ નં. ૨૦૯ (એ-૨૦૩), વિંગ એલ (માર્કેટિંગ પ્લાન મુજબ બિલ્ડીંગ એ
શ્રી મનોજ કુમાર	05-05-6068	વાર્યાનાલ રેસિડેન્સી રેવન્થુ સર્વે નં. ૭૬/૧, ૭૬/૨, ૭૬/૪, મુકામ–લાનગઢ
શ્રા મનાજ કુમાર શ્રીમતી રંજીતા દેવી	३।. १०१५६६०/-	પાયાનાથ રાસડન્સા રવન્યુ સવ ન. જ.,૧, ૭૬,૪, ૭૬,૪, મુકામ-થાનગર દેવગીરીજા, રેલ્વે સ્ટેશન થી વાગડિયા રોડ, તાલુકો-થાનગટ, જિલો
આનતા રસવા દવા	वा. पणपपस्ड्०/-	
L	<b></b>	સુરેન્દ્રનગર-3દ્3૫૩૦
લોન કોડ : APP-041-027	02-02-5058	ફ્લેટ નં. ૩, દેવગંગા એપાર્ટમેન્ટ, દેવગંગા એપાર્ટમેન્ટ રેવન્થુ સર્વે ન
શ્રીમતી જ્યુબેન ભરવાડ	l	૧૫૫/૧/પૈકી, ટીપી સ્કીમ નં. દૃષ્ઠ, એફ.પી. નં. ૮+૯, સબ પ્લોટ નં. ૧૧+૧૪+૧૫
શ્રી ભારતભાઇ ભરવાડ	३।. ९४०३०२०/	મુકામ-ઘોડાસર, સમીર હોટેલ પાસે, ઘોડાસર રોડ, તાલુકો-મણિનગર, જિલો
		અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૫૦
		· ·
લોન કોડ : APP-046-896	08-08-5058	ક્લેટ નં. ટી ૩, ૧૨ (ટાઇપ સી–૧), ઇન્ડિયાબુલ્સ સેન્ટ્રમ સિટી સર્વે નં. ૯૨૦, ટીપ
શ્રીમતી પુર્મિમાળેન હડિયેલ	l ——	સ્કીમ નં. ૧૬, એફ.પી. નં. ૧૧૪, વોર્ડ નં. ટીપી ૧૬ નં. ૨, મુકામ–શહેર કોટડ
શ્રી ધવલકુમાર હડિયેલ	રૂા. ૧૩૨૫૩૧૩/	સુમેલ ૧૦ પાસે, અનિલ સ્ટાર્ચમીલ રોડ, તાલુકો-મણિનગર, જિલો-અમદાવાદ
શ્રીમતી કર્યાબેન કડિચેલ		ગુજરાત-૩૮૦૦૧૮
લોન કોડ : APP-054-372	05-05-5058	ફલેટ નં. દૃ૦૫, ઇ, રુપ એવન્યુ સર્વે નં. ૧૨૬૫/૧, ટીપી રકીમ નં. ૧૨૮, એકપી ન
શ્રી પ્રવિભસિંહ ચાવડા	. ,	૨૫૨/૧, મુકામ–વટવા, રુપ વાકિત પાસે, તાલુકો–વટવા, જિલો અને પેટા જિલો
શ્રીમતી રિંકુબેન સાવડા	31. 9805508/-	અમદાવાદ-૩૮૨૪૪૦
Glot 5lS : APP-016-123	43-01-5058	ફ્લેટ ન. ૨૧૫, એ ૫ (ટાદપ બી), આવાસ-ફેઝ ૨, સર્વે નં. ૪૫૪/૧ અન્
શ્રીમતી સુધાબેન રવિભાઇ પરમાર	43-04-4048	૪૫૪/૨/૧/પૈકી, કેસર સિટી પાસે, ઝાચક્સ રિસર્ચ સેન્ટર પાછળ, સરખેજ બાલા
શ્રી રવિકુમાર ભરતસિંહ પરમાર	રૂા. ૨૬૯૧૯૨/–	કાઇવે, મોર્ટેચા–સાંગોદર–૩૮૨૨૧૩, અમદાવાદ
SI EIGSHE HEIRIGGENE	\$1. 450404/-	GIOU, MEUI-MUICE-SCEELS, OMCIGIC
લોન કોડ : APP-013-881	40-03-5058	કલેટ નં.એલઆઇજી–૨/આઇ/૮૦૩, ગોરવા એલઆઇજી–૨/૧, જીએસબી ગોરવ
શ્રીમતી મીનાબેન જીચાલાલ કામત	1 10 1110	લક્ષ્મીપુરા રોડ, આરાધના ડુપ્લેક્ષ પછી, વડોદરા–૩૯૦૦૧૬, ગુજરાત
શ્રી જીયાલાલ ભોઇજી કામત	31. 326898/-	المعادية الم
શ્રી સંતોધ જીયાલાલ કામત	इत. उरस्कपर्/-	
લોન કોડ : APP-058-006	90-00-2028	ફ્લેટ નં. ૧૦૫, અવદા રેસિડેન્સી, અવદા રેસિડેન્સી (સહારા પાર્ક) બ્લોક નં. પઠલ
	72-09-4058	
શ્રી ગુફુ સિંઘ		પ્લોટ નં. ૧૨, મુકામ–સાચણ, સાચણ સીએનજી પંપ સામે,સાચણ કીમ રો:
શ્રીમતી કૌરાલ્યા	३१. ०००६५८/-	તાલુકો-ઓલપાડ, જિલો-સુરત, ગુજરાત-૩૯૪૧૩૦
(a) of 5).5 : APP-058-679	40-00-5058	કલેટ નં. ૭૦૯, સાંઇ લક્ઝુરિયા (પ્લાન મુજબ બ્લોક –એ), સાંઇ લક્ઝુરિયા સિ
શ્રી શેખ જાવેદઅહેમદ,		સર્વે નં. ૨૯૨૫ અને ૨૯૨૭, મુકામ-વાપી, વાપી ટેલ્વે સ્ટેશન સામે, સ્ટેશન રો:
	1	Lucia and Gra account secure
l		
લોન કોડ : APP-012-843	01-01-5052	ફતેલ નં. જી–૨૦૬, જી, વુલા–ઇલાલ-પુએસ–સેવાસી– લીપી નં. ૧, એ.પી. નં.
શ્રીમતી જ્થશ્રીબેન નટુભાઇ પ્રજાપતી,	l	૧૧૯, ઇક્કાદ-પુએસ-સેવાસી, લીધી નં. ૧, એધી નં. ૧૧૯, રાદોશનાન એપાર્લનેન્લ
	-	I was a sum of the sum
3		
30000000		
લોન કોડ : APP-040-634	02-02-5052	
લોન કોડ : APP-040-634 શ્રીમતી કાંતી દેવી	06-06-5052	રદ્દ, ૩૦ (અમાલ્ગેશન પછીનો નવો બ્લોક નં. ૨૫), મુકામ–હલદ્યારુ, ગાર્ડન સિર્ટ
	\$1. 065££6/-	રદ્દ, ૩૦ (અમાલ્ગેશન પછીનો નવો બ્લોક નં. ૨૫), મુકામ–હલદ્યારુ, ગાર્ડન સિર્ટ
શ્રીમતી કાંતી દેવી		રદ્દ, ૩૦ (અમાલ્ગેશન પછીનો નવો બ્લોક નં. ૨૫), મુકામ–હલદ્યારુ, ગાર્ડન સિર્ટ
શ્રીમતી કાંતી દેવી		રદ, ૩૦(અમાદગેજાન પછીનો નવો ગલોક નં.૨૫), મુકામ-હલદાારુ, ગાર્ડન સિર્દ હલધારુ પરબ રોડ, તાલુકો–કામરેજ, જિદ્યો–સુરત, ગુજરાત-૩૯૪૩૧
શ્રીમતી કાંતી દેવી શ્રી બિનેશ કુમાર સિંઘ લોન કોડ : APP-043-875	३।. ७६२६६६/-	રદ્દ, ૩૦(ઝમાલ્ગેજનપછીનો નવો ગ્લોકનં. ૨૫), મુકામ-હલધારુ, ગાર્ડનસિર્દ હલધારુ પરંબ રોડ, લાલુકો–કામરેજ, લિકો–સુરત, ગુજરાત-૩૯૪૭૧ ફ્લોટનં. ૧૧, બ્લોકનં. બી, સુર્ચોદયપાર્ક રેવન્યુ સર્વે નં. દ્દરાર, દ્દરક, મુકામ
શ્રીમતી કાંતી દેવી શ્રી બિનેશ કુમાર સિંઘ લોન કોડ : APP-0/3-875 શ્રી ચંદ્રકાંત રોહિત	\$1.065686/-	રદ્દ, ૩૦ (અમાલગેલાન પછીનો નવો બ્લોક નં. ૨૫), મુકામ-હલદાદ, ગાર્ડન રિકર્દ હલદારુ પરંબ સેડ, તાલુકો-કામરેજ, વિદ્યો-સુરત, ગુજરાત-કલ્કરવ ક્લેટનં. ૧૧, બ્લોક નં. બી, સુર્યોદયા પાર્ક રેવન્યુ સર્વે નં. દ્વરા, દ્વાર, દુકા, મુકામ ગોગી, અમીન પાર્ટી પ્લોદ પાસે, ગોગી સેડ, તાલુકો-વડોદરા, વિદ્યો-વડોદર
શ્રીમતી કાંતી દેવી શ્રી બિનેશ દુમાર સિંઘ લોન કોડ : APP-013-875 શ્રી ચંદ્રકાંત રેહિત શ્રીમતી ગાસપીબેન રોહિત	\$1. 062556/- 05-05-2028 \$1. 9992649/-	રદ, ૩૦ (ઝમાનગેજન પછીનો નવો ગલો કને સ્ય), મુકામ-હલધારુ, ગાર્ડન સિર્દ હલધારું પડબ સેડ, તાલુકો-કામરેખ, વિતો-સુરત, ગુજરાત-કરકરક જોટો, અમિત પાર્ટી કર્યા કરો
શ્રીમતી કાંતી દેવી શ્રી બિનેશ કુમાર સિંઘ લોન કોડ : APP-013-875 શ્રી ચંદ્રકાંત રોહિત શ્રીમતી ગાસ્ત્રીબેન રોહિત લોન કોડ : APP-018-073	\$1.065686/-	ચક્ર, 30 (વસ્માઓના વાંધીનો વાંતી લહી કર્યાં 3, મુકામ-દાલાક). પાકંત ફિર્દ દાલાક: પારંગ સેંદ્ર, તાલુકો-કામોર્ય, જિલો-સુરત, ગુપરાત-દાલ્યક કેઈન નાં ૧૧, ત્યોક નાં તેની, સુર્વેદાલ પાર્ચ રેવાન્યુ સર્વે નાં. ૧,૩૩, ૬૩, ૧,૩૭, મુકામ ગોરી, કમામા થાદી પાર્ટેટ પાર્ચ, ગોરી વેરેક, તાલુકો-વાર્ટેટરા, શિલો-વાંદેટર ગુપરાત-દાલ્યલ કહેર નાં ત્યો-ભાગ, ટાવાર સી, શ્રી ફિલ્દુનેશાર દહેલીનેશર રેવાન્યુ સર્વે નાં. ૧૩૩, દી
શ્રીમતી કાંતી દેવી શ્રી બિનેલ કુમાર સિંઘ લોન કોડ : APP-043-875 શ્રી ચંદ્રકાંત રોહિત શ્રીમતી ગાયરોપિન રોહિત લોન કોડ : APP-048-073 શ્રી હર્પયુમાર શાહ	31. 965626/- 31. 965664/- 31. 9656644/-	શ્ર, 30 (વ્યાવભીતા વાંચકોના વાંચ (વાંચ નાં ચા), // 401-00 (વાંચા-), પાર્ટન દિર્દ ઉલાંચા: પારંગ રોડ, લાલુંકો-914મેં, // 18/1-પુરાત, ગુજરાત-15:295 ઇંદેર ને ૧૧, લ્લોક અને લી, સુર્યોદયામાં ઇંદેરન્યુ સર્વેની, 15.), (ડા, /, (3.9. ), 1944- ગોરી, અભીન પાર્ટી પાર્ટર પાર્ટ, ગોલી રેડ, લાલુંકો-વડાંટરા, (ભાને –વડાંટર ગુજરાત-15:496) ઇંદેર ને ની. 1940-01, હાલ સી, શ્રી સ્ટિફ્લેશક (સોનીસર રેલાવ્યુ વર્ષ નો. 4.33), લાલુંકો- ઇંદ્રીમાં નો. 8, 1940-01, હાલ સી, શ્રી સ્ટિફલેશક (સોનીસર રેલાવ્યુ વર્ષ નો. 4.33), લાલુંકો
શ્રીમતી હાંતી દેવી શ્રી વિભેગ કુમાર સિંઘ લોલ કોડ : APP-043-875 શ્રી ચંદ્રકાંત રોહિત શ્રીમતી ગાલગીએલ રોહિત લોલ કોડ : APP-046-073 શ્રી હર્યદ્વ માર ગાહ શ્રીમતી શ્રી ગાલ	\$1. 062556/- 05-05-2028 \$1. 9992649/-	ઘર, 30 (લામાં ભાગાને ભાગોનો ના બેલા તેને નથી, મુશન-હલાંઘર, ગાર્કન કિર્દે લાધાં ખારત એક. તાલુકો-કામનેજ, રિલો-ફરત, ગુજવાન-કરવાગ તેરે હતે ન ૧, ૧૯લેક ન તી, સુધોદન પાર્ફ રે હત્યું સર્તો ન (.33, 5, દૂક, દૂ, 5, 5, 5, 5, 5, 5, 5, 5, 5, 5, 5, 5, 5,
શ્રીમતી કાંતી દેવી શ્રી બિનોલ કુમાર સિંઘ લોના કોક : APP-043-875 શ્રી ચંદ્રકાંત રોહિત શ્રીમતી ગામગીબેન રોહિત લોના કોક : APP-046-873 શ્રી હર્યકુમાર શાહ	31. 965626/- 31. 965664/- 31. 9656644/-	શ્ર, 30 (વ્યાવભીતા વાંચકોના વાંચ (વાંચ નાં ચા), // 401-00 (વાંચા-), પાર્ટન દિર્દ ઉલાંચા: પારંગ રોડ, લાલુંકો-914મેં, // 18/1-પુરાત, ગુજરાત-15:295 ઇંદેર ને ૧૧, લ્લોક અને લી, સુર્યોદયામાં ઇંદેરન્યુ સર્વેની, 15.), (ડા, /, (3.9. ), 1944- ગોરી, અભીન પાર્ટી પાર્ટર પાર્ટ, ગોલી રેડ, લાલુંકો-વડાંટરા, (ભાને –વડાંટર ગુજરાત-15:496) ઇંદેર ને ની. 1940-01, હાલ સી, શ્રી સ્ટિફ્લેશક (સોનીસર રેલાવ્યુ વર્ષ નો. 4.33), લાલુંકો- ઇંદ્રીમાં નો. 8, 1940-01, હાલ સી, શ્રી સ્ટિફલેશક (સોનીસર રેલાવ્યુ વર્ષ નો. 4.33), લાલુંકો
શ્રીમતી કાંતી દેવી શ્રી બિનેલ કુમાર સિંઘ (તોલ કીક : ૧૦૦૦ વાંક શરક શ્રી સંકુકાંત રહિત શ્રીમતી આશ્ચોરીએલ સહિત (તોલ કીક : ૧૦૦૦ વાંક શ્રી શ્રીમતી સ્થિશ શાહ શ્રીમતી સિંશા શાહ શ્રીમતી ભાદી કાંબેલ લાહ	\$1. 962556/- \$1. 992649/- 05-05-5058	ચર, 30 (લખારાભા વર્ષાઓના તો બાંગી હતો. ને પાં), મુશામ-તાલાકા, ગાંહની હિંદી લહાંકાં પારંભ રોડ, તાલુંકો-કાનરેજ, વિતો-સુરત, ગુજરાત-ગદલગર કરેલાં કરે હતાં નવ, પતંચે તો હતો. તે હતો હતો હતો હતો હતો હતો. તે હતો હતો હતો હતો હતો હતો હતો હતો. તે હતો
ક્રમના કાંત્રી હેતી ક્રી બિનોલ કુમાર સિંઘ લોન લોક : મગ્મ-બાડ-લાજ ક્રીમના આવ્યોબેન સોહિત ક્રીમના આવ્યોબેન સોહિત લોન શોક : મગ્મ-બાદ-લાજ શ્રીમના સિંહા લાલ શ્રીમના લાલ લાલ ક્રીમના લાલ લાલ	31. 965626/- 31. 965664/- 31. 9656644/-	થક, 30 (લામાં ઉપલયં નિવાસ નિવ
ક્રોમતી કરી હોતી દેવી કો દિલ્લેગ કુમાર સિંઘ લોન કોડ ; APP-013-875 ક્રી સંફ્રકાંત રેહિત સ્ક્રીમતી આપવામીલન રોહિત લોન કોડ : APP-06-073 ક્રી હોલ્લું માર આઠ ક્રીમતી લાગ ક્રીમતી લાગ ક્રીમતી લાગ હાલ હોલ કોડ : APP-052-850 ક્રી પ્લાવ સ્ક્રી	31. 464626/- 31. 464626/- 31. 464626/- 31. 464626/-	વર, 30 (લખારાભા વાપામોનો નાવો બાંધો ને નથી, મુંકામ-હલાંકા, ગાંહના હિર્દ લાક્ષા અપલ એક. તાલુકો-કામલેજ, રિલો-સુરત, ગુખરાત-કરકામ હિર્દ ન લગ્ન, રહોલ નહીં, સુંદ્રોદ માર્ચ કે વેચનુ તર્યા ને : (3,5,5,5,5,5,9,5)મ એકોની, અભીના પાર્ટી પાર્ટી હતો. અને કે એક. તાલુકો-વહેદરન, કિલો-વહેદર, કિલો-વહેદર, કિલો-વહેદર, તારા રહે. શ્રી કિર્દ હતા કરી, શ્રી કિર્દ હતા હતા રહે. શ્રી કિર્દ હતા હતા રહે. શ્રી કિર્દ હતા હતા રહે. શ્રી કિર્દ હતા કરી, શ્રી કિર્દ હતા કરી, એફ જ તર્ય ન .13,5, દી હતા કરી કિર્દ હતા હતા રહે. શ્રી કર્યું કરામ હતા રહે. શ્રી કરી કરી કરી કરી કરી કરી કરી કરી કરી ક
ક્રમના કાંત્રી હેતી ક્રી બિનોલ કુમાર સિંઘ લોન લોક : મગ્મ-બાડ-લાજ ક્રીમના આવ્યોબેન સોહિત ક્રીમના આવ્યોબેન સોહિત લોન શોક : મગ્મ-બાદ-લાજ શ્રીમના સિંહા લાલ શ્રીમના લાલ લાલ ક્રીમના લાલ લાલ	\$1. 962556/- \$1. 992649/- 05-05-5058	કંદરે ન તી. માના, ટાવાર સી. શ્રી વિદેશવાદ લોકોએક રેખાવ વર્ષે નાં 33, 314 હતો. તેનું કરા લઈ રહ્યું લાકાઇ સીમાં ને, 9 કાકાબ રહ્યોં, તેનુંવાલ વાર્ડ રહ્યું લાકાઇ મોટાના મહાદે વાર્ડ કરે કર્યું લાકાઇ મોટાના સાથે તેનું કરો કરે કર્યું લાકાઇ પ્રોત્યાના સાથે તેનું કરો
ક્રોમતી કરી હોતી દેવી કો દિલ્લેગ કુમાર સિંઘ લોન કોડ ; APP-013-875 ક્રી સંફ્રકાંત રેહિત સ્ક્રીમતી આપવામીલન રોહિત લોન કોડ : APP-06-073 ક્રી હોલ્લું માર આઠ ક્રીમતી લાગ ક્રીમતી લાગ ક્રીમતી લાગ હાલ હોલ કોડ : APP-052-850 ક્રી પ્લાવ સ્ક્રી	31. 464626/- 31. 464626/- 31. 464626/- 31. 464626/-	વર, 30 (લખારાભા વાપામોનો નાવો બાંધો ને નથી, મુંકામ-હલાંકા, ગાંહના હિર્દ લાક્ષા અપલ એક. તાલુકો-કામલેજ, રિલો-સુરત, ગુખરાત-કરકામ હિર્દ ન લગ્ન, રહોલ નહીં, સુંદ્રોદ માર્ચ કે વેચનુ તર્યા ને : (3,5,5,5,5,5,9,5)મ એકોની, અભીના પાર્ટી પાર્ટી હતો. અને કે એક. તાલુકો-વહેદરન, કિલો-વહેદર, કિલો-વહેદર, કિલો-વહેદર, તારા રહે. શ્રી કિર્દ હતા કરી, શ્રી કિર્દ હતા હતા રહે. શ્રી કિર્દ હતા હતા રહે. શ્રી કિર્દ હતા હતા રહે. શ્રી કિર્દ હતા કરી, શ્રી કિર્દ હતા કરી, એફ જ તર્ય ન .13,5, દી હતા કરી કિર્દ હતા હતા રહે. શ્રી કર્યું કરામ હતા રહે. શ્રી કરી કરી કરી કરી કરી કરી કરી કરી કરી ક

. 5લેટ નં. સી-૧૦૨, ટાવર સી, શ્રી સિદ્ધેશ્વર હોલિનેશ રેવન્યુ સર્વે નં. ૧૩૩, ટીપી રકીમ નં.૧, ફાઇનલ પ્લોટ નં. રજ, મુકામ–હરશી, સીગ્રજનુસ વર્લ્ડ સ્કુલ પાઇ મોટનાથ મહાદેવ મંદિર રોડ, તાલુકો–વડોદરા, જિલો–વડોદરા, ગુજરા ૧૯૦૨૨

ક્લેટ નં. ડી–૫૦૭, ડી, સોના આકૃતિ સર્વે નં. ૨૭૯, આકૃતિ, પ્રમુખ પાર્ક સામે ગેતરપુર, તાલુકો–દસ્ક્રોઇ, જિલો–અમદાવાદ–૩૮૨૪૩૫

માઇક્રો હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડ વતી

અધિકત અધિકાર્ર

તારીખ : ૧૮-૦૭-૨૦૨૧

નં. ૧૫૩/૧, જીઇળી ઓફીસ પાછળ, લક્ષ્મી નગર પાસે, નારોલ જુની કોર્ટ પાઇ રૂા. ૧૩૮૧૭૫/– નારોલ, અમદાવાદ–૩૮૨૪૦૫

થી હર્ષકુમાર શાહ શ્રીમતી રિચા શાહ શ્રીમતી ભાવિકાબેન શાહ

લોન કોડ : APP-008-897 શ્રીમતી ગુઠ્ઠીદેવી ચાદવ શ્રી સિપુ કલ્ચાણસિંદા ચાદવ શ્રી રામકેશ કલ્ચાણસિંદા ચાદ લોન કોડ : APP-004-718

થી પુરુષોત્તમ લવજીભાઇ પરમાર

સ્થળઃ ગુજરાત

તારીખ : ૧૮/૦૭/૨૦૨૪

31. 963840/-

### ઇન્ટિકા શેલ્ટર ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડ

રશાવા કાશાસ કારા કરતે. આ જો માળા રહ્યા કાલક શાહાર છે. પાસ રશાવાર માલા કતા માટે કળ જાત નાદેરી સા

દેવાદાર/જામીનદાર (મિલકતના માલિક) નું નામ અને લોન એકાઉન્ટ નંબર	હિસ્સા)	માંગણા નોટીસ તારીખ માંગણા નોટીસની તારીખ મુજબ બાકી સ્ક્રમ	કબજાની તારીખ
શ્રીમતી અંધુબેન પંજાગી અને શ્રી રવિલ્લુત્તાઇ પંજાગી, તમામનું સરનામું : ગાસ્ત્રી નગર તારાપુર આદંદ, ગુજરાત-૩૮૮૧૮૦ લોન એકાઉન્ટ નંબર La38clions0000503883, La38clions00005087035	રેહાન્યું કર્યો નં. પ્ર. કિટી રહે નં. રખદ., તે લોઉં, પલેટ નં. 3/એ, ગ્રામ ચોચાર બિરલાન તે પ્રત્ય કે પ્રત્ય કે પ્રત્ય કે ગ્રામો, ગ્રામ ચોચાર બિરલાન તે પ્રત્ય કે પ્રત્ય	રૂા. ૧૩,૦૯,૪૨૩/– (રૂપિયા તેર લાખ નવ હત્તર સારસો ગેવીસ પુરા) ૦૬.૦૨.૨૦૨૪ નાં રેજ બાકી તેમજ ૦૭.૦૨.૨૦૨૪ થી વ્યાજ	૧૩.૦૭.૨૦૨૪ (સાંકેતિક કબજો)

Home Loans

### 

(Ringues in Mileuro (1))

[Rissil (Ringues) (

દેવાદારો/સહ–દેવાદારો/ગીરવેદાર/ જામીનદારોનાં નામ/ લોન નંબર	૧૩(૨) નોટીસની તારીખ અને રકમ	ગીશે મિલકતની વિગત	
(A/c No.) L9001060115989059 સોની અશોકભાઇ (દેવાદાર), શ્રીમતી સોની શાહિલા (સહ-દેવાદાર), તુપાર અશોકભાઇ સોની (સહ-દેવાદાર)	૧૪–૦૬–૨૪ રૂા. ૫૫૯૭૩૦/– (રૂપિયા પાંચ લાખ ઓગણસાહીઠ હજાર સાતસો ત્રીસ પુરા) ૧૧–૦૬–૨૪ મુજબ	મુકામ–સર્વે નં. ૧૩૩ ર બી, પ્લોટ નં. ૨૦૬, ફલેટ નં. ૪ મિલકત નં. ૭૧૭૦ ૩, ગ્રાઉક્ડ ફ્લોર, બ્લોક નં. ૧૦૯, શ્રી નિલાસ, ગ્રીન સિટી પાર્ટ–૨, ગામ–કાડોદરા, જિલો સુરત, ગુજરાત ખાતેની મિલકત. ક્ષેત્રફળ ૧૩.૮૮ શ્રો.મી.	
(A/cNo.) L9001060113114474 મહેશભાઇ કુલતરિયા (દેવાદાર), અતુલકુમાર જક્સાણીયા (સહ–દેવાદાર), જ્યંતિલાલ લુલતરિયા (સહ–દેવાદાર), શ્રીમતી હંસાબેન કુલતલિયા (સહ–દેવાદાર)	ર૧–૦૬–૨૪ રૂ. ૧૪૭૬૫૩૮/– (રૂપિયા ચૌદ લાખ છોતેર હજાર પાંચસો આડગીસ પુરા) ૨૦–૦૬–૨૪ મુજળ	મુકામ-પ્લોટ નં. ૧૩૩ અને ૧૩૪, ક્રમ નં. ૨૯૯/૩પૈકીવ ક્રમ નં. ૨૯૯/૩પૈકીર, ધરમગંગા સોસાચટી, સાંતિનગર પાસે, ન્યુ પીપલી, ઉત્તલો-મોરની, ગુજરાત ખાતેની મિલકત. ક્ષેત્રફળ ૨૦૫.૮૬ ચો.મી.	
(A/cNo.) L9001060120097880 ગોવિંદભાઇ નારાચાણભાઇ દરજી (દેવાદાર), શ્રીમતી હેસાએન ગોવિંદભાઇ દરજી (સહ- દેવાદાર), નારાચાણભાઇ મોહનભાઇ દરજી (સહ- દેવાદાર)	૧૪–૦૬–૨૪ રૂા. ૪૪૬૫૮૯/– (રૂપિયા ચાર લાખ છેતાલીસ હંજાર પાંચસો નેવ્યાંશી પુરા) ૧૧–૦૬–૨૪ મુજબ	મુકામ-મિલકત નં. ૮૭૦, મોજે-ભાલુસણા, પીઓ ભાલુસણા, જિયો-મહેસાણા, ગુજરાત ખાતેની મિલકત ક્ષેત્રફળ ૬૦૦ સો. ફુટ	
(A/cNo.) L9001070826351138 અમર શિંદા (દેવાદાર), સ્તન શિંદા (સહ–દેવાદાર)	૧૪-૦૬-૨૪ રૂ. ૧૫૨૭૫૨૨/- (રૂપિયા પંદર લાખ સત્યાવીસ હજાર પાંચસો બાવીસ પુરા) ૧૧-૦૬-૨૪ મુજબ	મુકામ-પ્લોટ નં. ૧૮૬, ગ્લોક નં. ૮૮/બી, ૧૦૧ અને ૧૦૨, ગ્લોક નં. ૮૮ બી ૧૮૬, સાંઘદિય રેલિકેન્શી, પલસાણા, ઉત્તો-ગુજરાત ખાતેની મિલકત. ક્ષેત્રફળ ૬૦.૨ થો.મી.	
(A/c No.) L9001060127786521 લુક્સર પ્રકાશભાઇ ગીરાણું (દેવાદાર), શ્રીમતી લુકાર રમિલાબેન પ્રકાશભાઇ (સંદ- દેવાદાર)	૧૪–૦૬–૨૪ રૂા. ૪૭૦૨૩૫/– (રૂપિયા ચાર લાખ સીતેર હજાર બરસો પાંત્રીસ પુરા) ૧૧–૦૬–૨૪ મુજબ	મુકામ-પ્લોટ નં. કદ્દ અને કદ્દ/૧, સર્વે નં. ૮૦/૧, ક્તેપુ: માલોતરા, દાનેસ, જિદો-બનાસકાંઠા, ગુજરાત ખાતેની મિલકત. <b>ક્ષેત્રફળ કદ .૩૨ ચો.મી</b> .	
(A/cNo.) L9001060729021508 ઉજ્ઞ્વલ જ્વેલર્સ (દેવાદાર), શ્રીમતી કહિયા વિદ્યિ ગુણવંતભાઇ (સહ–દેવાદાર), ચોપાનેરી પ્રણવકુમાર ચસર્વતભાઇ (સહ–દેવાદાર), કિશનકુમાર ચસર્વતભાઇ સૌની (જામીનદાર)	૧૫-૦૬-૨૪ જ્ઞ. ૩૦૨૦૬૩૮/- (રૂપિયા ત્રીસ લાખ લીસ હજાર છસ્સો આડગીસ પુરા) ૧૧-૦૬-૨૪ મુજબ	મુકામ–ચુલિટ લે. એસએફ–૧, (એસએફ ને. ૨૦૧), એસએફ–૨, (એસએફ ને. ૨૦૨), ઝેલિકા ભૂદન, ક્રમ નં. ૩૯૭, મોલે–જમાલપુટ–૨, લિકો–અમદાવાદ, ગુજરાત ખાતેની મિલકત. <b>ક્ષેત્રફળ ૨૩.૨૫ સો.મી.</b>	
તારીખ : ૧૬/૦/૧૦૨૪ સહી/- અધિકૃત અધિકારી સ્થળ : અમદાવાદ એસુ સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ			

## એ દેરાએ દારસું હાઉ રિાં⊃ા ફારાળાાળરા હાીે⊁ાીટેડ (CIN:Le5922RJ1999PLC015440)

# Seq. Ale Din Glat Dindon, sured selected, Edge - Asset (server), described contents (see a indiginary locating com distance : www.seghousing - 본 경우 전 한 등 조 , ૨૦૦૨ 에 등 대한 역 (২) 중동 에 등 바다 중 에 급하는

રખે લીકે પાયકો દેવાદ, મા- દેવાદા (દે.), ગોલેકાડ(શ) અને ખર્ચનિવાદ(શ) અહીં થઈ લાંધા તે તીક લેકોલ ) એ લેકાળાવું હાર્દિના ફાયના વર્ષિકા (લિકાસાનું કહેલો કહેલો એનો લેવાદ હાર્દિ (લિકાસાનું કહેલો કહેલો નો મોના કહ્યું લાંધા કહેલા કહેલા

- 1				earde indear(ai) on idola (anioi eloi	i
- 1		લોન એકાઉન્ટ નંબર (લોન)/		જમીન સાથે જેડાકેલ કોઈપણ વસ્તને જેડાકેલ	i
- 1		દેવાદાર/સહ-દેવાદાર/જામીનદાર –		ફિક્સ્સ્સે અને ફિટીંગ્સની સાથે તેનો પર બધારોલ	l
- 1			-,	अथवा जधानार ।जल्डाञ्स सन माणजासा	ī
ı	ш			સહિત)	ı
- 1	٩	HLR00000000013871 શ્રી પંકજકમાર કિશનભાઇ ગામીત જે શ્રી	૧. માંગણા નોટીસની તારીખ :	શ્રી કિશનભાઇ સંકરભાઇ ગામીત જે શ્રી સંકરભાઇ	ı
- 1		કિશનભાઇ ગામીતના પુત્ર (દેવાદાર),	29-04-2028	ગામીતના પત્નીના નામે રહેલ ગામ પંચાયત	ı
- 1		શ્રીમતી શાકુબેન કિશનભાઇ ગામીત જે	૨. માંગણા નોટીસ મુજબ દાવાની ૨૬મ:	મિલકત નં. ૭૫/૧, નિશાળ ફળિસા, ગામ–ઇન્દુ	ı
- 1		શ્રી કિશનભાઇ ગામીતના પત્ની (સદ્-	રૂા. ૫૩૬૨૫૦/– (રૂપિસા પાંચ લાખ છત્રીસ	(ગામતળ), તાલુકો–વ્યારા, જિલો–તાપી,	ı
- 1		દેવાદાર-૧), શ્રી કિશનભાઇ શંકરભાઇ	હજાર બરસો પરથાસ પરા) ૨૪–૦૪–૨૦૨૪	(ગુજરાત) ખાતેની જમીનના તમામ ભાગ અને	ı
- 1		ગામીત જે શ્રી સંકરભાઇ ગામીતના પત્ની	મજબ વત્તા ૨૫-૦૪-૨૦૨૪ થી લાગ સડત	હિસ્સા. ક્ષેત્રફળ આશરે ૧૧૩૪.૦૦ ચો. કુટ,	ı
- 1		(સહુ–દેવાદાર–્ર), શ્રીમતી અંકિતાબેન્	વ્યાજ, આકરિમક ખર્ચ, કોસ્ટ, સાર્જ વગેરે.	ચતુઃસીમા : પૂર્વ : રાકેશભાઇની મિલકત, પશ્ચિમ :	ı
- 1		ગામીત જે શ્રી શૈલેષભાઇ ગામીતના પત્ની (સહ–દેવાદાર–૩), શ્રી ભાવેશકુમાર	,	રોડ, ઉત્તર : ખુલી જગ્યા, દક્ષિણ : ખુલી જગ્યા	ı
- 1		નાનજીભાઇ સોલંકી જે શ્રી નાનજીભાઇ			ı
- 1		સોલંકીના પુત્ર (જામીનદાર)			ı
ŀ	5	HLR00000000013519	૧. માંગણા નોટીસની તારીખ :	શ્રીમતી પારુલબેન જલ્પેશભાઇ રવાસારી જે શ્રી	ı
- 1	•	શ્રી રવારાણી જલ્પેશભાઇ ભીખુભાઇ જે શ્રી	22-04-2028	જલ્પેશભાઇ સ્વાસાણીના પત્નીના નામે રહેલ	ı
ı				Accessed Edicion district out Edica	ŀ
- 1			E. THERE THERE 3 THE CHAPTER CO. 10.	ટાઉનશિપ ભાગ-૩ તરીકે જાણીતી બિલ્ડીંગ, કલેટ	i
- 1	П	શ્રીમતી રવારાણી પારુલબેન જલ્પેશભાઇ	દ્૧૪૨૨૦/– (રૂપિયા છ લાખ સૌદ હજાર	નં. ૧૦૨, જમીનનો ટેવન્યુ સર્વે નં. ૧૭૬, બ્લોક નં.	ı
- 1		જે શ્રી જલ્પેશભાઇના પત્ની (સહ-દેવાદાર)	બરસો વીરા પુરા ) ૧૩–૦૫–૨૦૨૪ મુજબ વતા	૧૦૦, ગામ-પાસોદ્રા, તાલુકો-કામરેજ, જિલો-	ı
		શ્રી પરમાર વિપુલ શાંતિલાલ જે શ્રી	૧૦-૦૩-૨૦૨૪ થી લાગુ ચડત વ્યાજ,	સરત. (ગુજરાત) ખાતેની જમીનના તમામ ભાગ	L
П		શાાતલાલના પુત્ર (જામાનદાર)	આકરિમક ખર્ચ, કોસ્ટ, ચાર્જ વગેરે.	અને હિસ્સા. ક્ષેત્રફળ આશરે પર.૮૯ ચો.મી.,	í
- 1				ચતુઃસીમા : પુર્વ : બિલ્ડીંગ નં. ઇ, પશ્ચિમ : ફ્લેટ નં.	ı
- 1				૧૦૧, ઉત્તર : સોસાયટીનો રોડ, દક્ષિણ :	ı
- 1				પેશેજ/સીડીઓ	ı
ı	3	HLR00000000014664	૧. માંગણા નોટીસની તારીખ :	શ્રીમતી કંચનબેન ડાહ્યાભાઇ મૈસુરિયા જે શ્રી	ı
- 1		શ્રી ચેતનકુમાર લક્ષ્મણભાઇ મૈસુરિયા જે	29-04-2028	ડાહ્યાભાઇના પત્નીના નામે રહેલ ગ્રામ પંચાયત	ı
- 1		શ્રી લક્ષ્મણભાઇના પુત્ર (દેવાદાર) શ્રીમતી ભાગ્યશ્રી રોતનકુમાર મૈસુરિયા જે	૨. માંગણા નોટીસ મુજબ દાવાની ૨૬મ: રૂ.	મિલકત નં. દૃદ્દ૦, ગામ–ખારચ, તાલુકો–હાંસોટ,	ı
- 1		શ્રીમતા ભાગ્યશ્રા ચતનકુમાર મસુરિયા જ શ્રી રોતનકુમારના પત્ની (સફ-દેવાદાર-૧)	૭૩૫૮૫૦/- (રૂપિયા સાત લાખ પાંત્રીસ હજાર	િલ્લો-ભરૂસ, (ગુજરાત) ખાતેની જમીનના તમામ	ı
- 1		શ્રીમતી અરુણાબેન લક્ષ્મણભાઇ મેસરિયા	આઠસો પરચાસ પુરા) ૧૩–૦૫–૨૦૨૪ મુજબ	ભાગ અને હિસ્સા. ક્ષેત્રફળ આશરે કટર.૦૦ થો.	ı
- 1		જે શ્રી લક્ષ્મણભાઇના પત્ની (સદ-	વતા ૧૪–૦૫–૨૦૨૪ શ્રી લાગુ ચક્ત લ્યાજ,	કૂટ, ચતુઃસીમા : પૂર્વ : રોડ, પશ્ચિમ : મિલકત, ઉત્તર	ı
- 1		દેવાદાર-૨), શ્રીમતી કંચનબેન ડાહ્યાભાઇ	આકરિયક ખર્ચ, કોસ્ટ, સાર્જ વગેરે.	: રોડ, દક્ષિણ : મિલકત	ı
- 1		મૈસુરિયા જે શ્રી ડાહ્યાભાઇના પત્ની (સહ-	આંકાલ્મક બંધ, કારદ, વાપ વગર.		ı
- 1		દેવાદાર-૩), શ્રી રાજેશભાઇ છજ્ઞાભાઇ			
- 1					۱
		પ્રજાપતી જે શ્રી છજ્ઞાભાઇના પુત્ર			l
- 1		(જામીનદાર-૧), શ્રી વિનય મનોજમાઇ			l
١		(જામીનદાર-૧), શ્રી વિનય મનોજમાઇ મૈસુરિયા જે શ્રી મનોજમાઇના પુત્ર			
		(જામીનદાર-૧), શ્રી વિનય મેનોજમાઇ મૈસુરિયા જે શ્રી મનોજમાઇના પુત્ર (જામીનદાર-૨)	a situan addard arthur	offsul seeded bosses & of surficenses	
	×	(જામીનદાર-૧), શ્રી વિનય મેનોજમાઇ મૈસુરિયા જે શ્રી મનોજમાઇના પુત્ર (જામીનદાર-૨) HLR0000000014247	૧. માંગણા બોદીસબી તારીખ :	શ્રીમતી ઇન્દુલેન દેશમુખ જે શ્રી અરવિંદભાઇના	
	×	(જામીનદાર-૧), શ્રી વિનય મેનોજમાઇ મેસુરિયા જે શ્રી મનોજમાઇના પુત્ર (જામીનદાર-૨) HLR000000014247 શ્રીમતી ઇન્દુએન દેશમુખ જે શ્રી	99-05-2058	પત્નીના નામે રહેલ ઠાઉસ નં. ૧૩૮, ગામ-ધામા	
	×	(જામીનદાર-૧), શ્રી વિનય મેનોજમાઇ મૈસુરિયા જે શ્રી મનોજમાઇના પુત્ર (જામીનદાર-૨) HLR0000000014247	૧૧–૦૬–૨૦૨૪ ૨. માંગણા નોટીસ મુજબ દાલાની ૨૬મ: ગ્ર.	પત્નીના નામે રહેલ હાઉંસ નં. ૧૩૮, ગામ–ધામા ધુમા, તાલુકો–ખેરગામ, વિલો–નવસારી,	
	×	(જામીનદાર-૧), શ્રી વિનય મેનોજભાઇ મેશુરિયા જેથી મનોજભાઇના પુત્ર (જામીનદાર-૨) HLR00000000014247 શ્રીમતી ઇન્દ્રદુલેન દેશમુખ જે શ્રી અરવિંદભાઇના પત્ની (દેવાદાર),	૧૧–૦૬–૨૦૨૪ ૨. માંગણા નોટીસ મુજબ દાવાની ૨૬મ: રૂ. ૪૯૫૮૨૦/– (રૂપિયા ચાર લાખ પંચાણું હજાર	પત્નીના નામેં રહેલ હાઉસ નં. ૧૩૮, ગામ–ધામા ધુમા, તાલુકો–ખેરગામ, જિલો–નવસારી, (ગુજરાત) ખાતેની જમીનના તમામ ભાગ અને	
	×	(જમીનદાર-વ), શ્રી વિલય મેળોજમાઇ મૈસુરિસા જે શ્રી મળોજમાઇના પુત્ર (જમીનદાર-૨) HLR0000000014247 શ્રીમતી ઇન્દુરેલન દેશમુખ જે શ્રી અસ્વવિદભાઇના પત્ની (દેવાદાર), શ્રી અત્વિદભાઇ ઇસામાખ જે શ્રી ઇસ્ટલ્ન્દ્રમાલા ઇસામુખ જે શ્રી ઇસ્ટલ્ન્દ્રમાર વિલ્લુભાઇ મ્હલા જે શ્રી	૧૧–૦૬–૨૦૨૪ ૨. માંગણા નોટીસ મુજબ દાવાની ૨૬મ: ગ્ર. ૪૯૫૮૨૦/– (રૂપિયા ચાર લાખ પંચાણું હજાર આઠસો વીસ પુરા) ૧૦–૦૬–૨૦૨૪ મુજબ	પત્નીના નામે રહેલ હાઉંસ નં. ૧૩૮, ગામ-ધામા ધુમા, તાલુકો-ખેરગામ, જિલો–નવસારી, (ગુજરાત) ખાતેની જમીનના તમામ ભાગ અને હિસ્સા. ક્ષેત્રફળ આશરે ૧૪૫૦.૦૦ ટ્યો. ફુટ,	
	¥	(જમીનદર-વ.), શ્રી વિનાર મેં નોજનાઇ મંત્રુરિયા જે શ્રી માંગલમાઇના પુત્ર (જમીનદાર-૨) માના૦૦૦૦૦૦૦૦૧247 શ્રીમતી ઇન્દ્રદેશને દેશપુત્ર જે શ્રી અરવિંદભાઇના પાત્રી (દેવાદર), શ્રી અરવિંદભાઇ ક્લાબાઇ રેશપુત્ર બે શ્રી ઇન્દ્રશાબાઇના પુત્ર (સલ-દેવાદર-વ.), શ્રી દિશેન્દ્રશુપાર વિભૂભાઇ સ્વલા જે શ્રી વિભૂભાઇના પુત્ર (સલ-દેવાદર-વ.), શ્રી	૧૧–૦૬–૨૦૨૪ ૨. માંગણા નોટીસ મુજબ દાવાની ૨૬મ: ગ્ર. ૪૯૫૮૨૦/– (રૂપિયા સાર લાખ પંચાણું ૯જનર આઠસો વીસ પુરા) ૧૦–૦૬–૨૦૨૪ મુજબ વતા ૧૧–૦૬–૨૦૨૪ શ્રી લાગુ શક્ત વ્યાજ,	પત્નીના નામેં રહેલ હાઉંસ નં. ૧૩૮, ગામ–ધામા ધુમા, તાલુકો–ખેરગામ, વિદ્યો–નવસારી, (ગુજરાત) ખાતેની જમીનના તમામ ભાગ અને હિસ્સા. સેખફળ આશરે ૧૪૫૦.૦૦ ચો. સુટ, સતુઃસીમા: પુર્વ: સુમનભાઇની મિલકતા, પશ્ચિમ:	
	×	(જમીનદર-વ.), શ્રી વિનારા મેનોજનાઇ મંત્રુરિશા જે શ્રી મનોજનાઇના પુત્ર (જમીનદર:-૨) શ્રીમતી ઇન્દુર્યન દેશનુમ જે શ્રી અરવિદદમાઇના પાત્રી (દેવાદર:-૧), શ્રી શ્રીમતી ઇન્દુર્યના ઇશાનાઇ દેશનુમ જે શ્રી ઇશાભાઇના પુત્ર (સન્ટ-દેવાદર:-૧), શ્રી વિન્દુનાઇના પુત્ર (સન્ટ-દેવાદર:-૧), શ્રી વિન્દુનાઇના પુત્ર (સન્ટ-દેવાદર:-૧), શ્રી	૧૧–૦૬–૨૦૨૪ ૨. માંગણા નોટીસ મુજબ દાવાની ૨૬મ: ગ્ર. ૪૯૫૮૨૦/– (રૂપિયા ચાર લાખ પંચાણું હજાર આઠસો વીસ પુરા) ૧૦–૦૬–૨૦૨૪ મુજબ	પત્નીના નામે રહેલ હાઉંશ નં. ૧૩૮, ગામ–ધામા ધુમા, તાલુએ-ખેરગામ, જિલો–નવસારી, (ગુજરાત) ખાતેની જમીનના તમામ ભાગ અને હિસ્સા. ક્ષેત્રફળ આશરે ૧૪૫૦.૦૦ સો. ફુટ, સ્વતુસીમા: પુર્વ : સુમનનાકાની મિલકત, પશ્ચિમ : રોડ, ઉત્તર : કાળુનાકાની મિલકત, દક્ષિણ :	
٠	×	(જમીનદર-વ.), શ્રી વિનાર મેં નોજનાઇ મંત્રુરિયા જે શ્રી માંગલમાઇના પુત્ર (જમીનદાર-૨) માના૦૦૦૦૦૦૦૦૧247 શ્રીમતી ઇન્દ્રદેશને દેશપુત્ર જે શ્રી અરવિંદભાઇના પાત્રી (દેવાદર), શ્રી અરવિંદભાઇ ક્લાબાઇ રેશપુત્ર બે શ્રી ઇન્દ્રશાબાઇના પુત્ર (સલ-દેવાદર-વ.), શ્રી દિશેન્દ્રશુપાર વિભૂભાઇ સ્વલા જે શ્રી વિભૂભાઇના પુત્ર (સલ-દેવાદર-વ.), શ્રી	૧૧–૦૬–૨૦૨૪ ૨. માંગણા નોટીસ મુજબ દાવાની ૨૬મ: ગ્ર. ૪૯૫૮૨૦/– (રૂપિયા સાર લાખ પંચાણું ૯જનર આઠસો વીસ પુરા) ૧૦–૦૬–૨૦૨૪ મુજબ વતા ૧૧–૦૬–૨૦૨૪ શ્રી લાગુ શક્ત વ્યાજ,	પત્નીના નામેં રહેલ હાઉંસ નં. ૧૩૮, ગામ–ધામા ધુમા, તાલુકો–ખેરગામ, વિદ્યો–નવસારી, (ગુજરાત) ખાતેની જમીનના તમામ ભાગ અને હિસ્સા. સેખફળ આશરે ૧૪૫૦.૦૦ ચો. સુટ, સતુઃસીમા: પુર્વ: સુમનભાઇની મિલકતા, પશ્ચિમ:	
		(જમીનદર-વ.), શ્રી વિનારા મેનોજનાઇ મંત્રુરિશા જે શ્રી મનોજનાઇના પુત્ર (જમીનદર:-૨) શ્રીમતી ઇન્દુર્યન દેશનુમ જે શ્રી અરવિદદમાઇના પાત્રી (દેવાદર:-૧), શ્રી શ્રીમતી ઇન્દુર્યના ઇશાનાઇ દેશનુમ જે શ્રી ઇશાભાઇના પુત્ર (સન્ટ-દેવાદર:-૧), શ્રી વિન્દુનાઇના પુત્ર (સન્ટ-દેવાદર:-૧), શ્રી વિન્દુનાઇના પુત્ર (સન્ટ-દેવાદર:-૧), શ્રી	૧૧–૦૬–૨૦૨૪ ૨. માંગણા નોટીસ મુજબ દાવાની ૨૬મ: ગ્ર. ૪૯૫૮૨૦/– (રૂપિયા સાર લાખ પંચાણું ૯જનર આઠસો વીસ પુરા) ૧૦–૦૬–૨૦૨૪ મુજબ વતા ૧૧–૦૬–૨૦૨૪ શ્રી લાગુ શક્ત વ્યાજ,	પત્નીના નામે રહેલ હાઉંશ નં. ૧૩૮, ગામ–ધામા ધુમા, તાલુએ-ખેરગામ, જિલો–નવસારી, (ગુજરાત) ખાતેની જમીનના તમામ ભાગ અને હિસ્સા. ક્ષેત્રફળ આશરે ૧૪૫૦.૦૦ સો. ફુટ, સ્વતુસીમા: પુર્વ : સુમનનાકાની મિલકત, પશ્ચિમ : રોડ, ઉત્તર : કાળુનાકાની મિલકત, દક્ષિણ :	
		(જમીનાદર-ન), શ્રી વિભય મનોભગા મૃત્રિયાએ જમી મનેભગાના પુત્ર (જમીનાદર-ન) મન.5000000014247 શ્રીમતી પ્રદુવને દેશપુન જે શ્રી અરહિદંદભાઇના પાત્રી (દેલાદાર), શ્રી અરહિદદભાઇ ભાગાઈ રમાપુન જે શ્રી અરહિદદભાઇ પાત્ર (સ્ત-દેલાદર-ન), શ્રી વિત્યુનક્ષામાં દેશપુના જેના શ્રી વિત્યુનક્ષામાં દેશપુના જેના શ્રી વિત્યુનક્ષામાં દેશપુના જેના શ્રી હરસાઇ કરસ્યનભાઈ સ્થાપુન જેની કરસાઇ કરસ્યનભાઈ સ્થાપુન જેની	૧૧-૦૬–૨૦૨૪ ૨. માંગાય નોદીસ મુજબ દાલાની ૨૬મઃ ગ્ર. ૪૯૫૨૦૦/- (ગ્રેપિયા ચાર લાખ પંચાણું હજાર આઠસો વીસ પુત્ર) ૧૦-૦૬–૨૦૪૪ મુજબ વાલા ૧૧-૦૬–૨૦૪૪ શ્રી લાગુ ચક્ક વ્યાપ, આકરિમક ખર્ચ, કોસ્ટ, ચાર્જ વગેરે.	પત્નીના નામે રહેલ હાઉંસ નં. ૧૩૮, ગામ-હામા ધૂમા, તાલુકો-ખેરગમા, જિદ્દો-નવસાસી, (ગુજરાત) ખાતીની ભમીનના તમામ ભાગ અને હિસ્સા. ક્ષેત્રફળ આસરે ૧૪૫૦.૦૦ ચો. ફુટ, ચતુસીમા: પૂર્વ: સુમનભાદાની મિલકત, પશ્ચિમ: સ્કેડ, ઉત્તર: કાંગુભાદાની મિલકત, દક્ષિણ : સુમનભાદાની મિલકત	
		(જમીનાદર-ન), ક્રી વિભય મંભીભાઇ મેફિલિય જેની મહેલાઇના પુત્ર (જમીનાદર-ર) મેફિલિયા જેની મહેલાઇના પુત્ર (જમીનાદર-ર) ક્રીમતી દાવ્યું એ દરમુખ જે બી અપ્લેટિલાઇમાં પ્રદાશભાઇ દેશમુખ જે બી અપ્લાલાબામ પૂર્વ (સ્વેનાદર-ર), ક્રી અપ્લેટિલાઇ છાલાબાઈ દેશમુખ જે બી ઇપ્લાલાબામ પૂર્વ (સ્વેનાદર-ર), ક્રી દિશેન્દ્રસુભાઇ વિભૂગ વિખ્યું અપ્લેટાઇના ઇસ્લુખ જે બી ઉપલેલાઇક કરવાના દિશુખ જે બી અપ્લેટાઇનાઇક કરવાના દેશમુખ જે બી અપ્લેટાઇનાઇક કરવાના પ્રદાશ પ્રદેશ (સ્વેનાદર-ર), ક્રી અપ્લેટાઇનાઇક કરવાના પૂર્વ (જમીનાદર)	૧૧–૦૬–૨૦૨૪ ૨. માંગણ નોટીસ મુજબ દાલાળી રકમ: ગ્ર. ૧૮૫૮૨૦/– (સીસા સાર લાખ પંચાણું હજાર આહ્સો વીસ પુરા) ૧૦–૦૬–૨૦૨૪ મુજબ વલા ૧૧–૦૬–૨૦૨૪ શી લાગુ સડત ત્યાજ, આહસ્મિક ખસં, કોસ્ટ, સાર્જ વગેરે. ૧. માંગણ નોટીસની તારીખ : ૨૩–૦૫–૨૦૨૪	પ્રત્નીના નામે રહેલ લાઉશ નાં ૧૩૮, ગામ-વામા ધુમા, લાલુકો-એસ્ટામમ, જિલો-નલસારી, (ગુજરાત) ખાતેની જમીનના લામામ ભાગ અને હિસ્સા. શેગફળ આશરે ૧૪૫૦.૦૦ શી. ફુટ, વસ્તુઓશા: પૂર્વ સુમનનામાની મિલત, પશ્ચિમ: રોડ, ઉત્તર : કાળુભાઇની મિલકત, દક્ષિણ : સુમનભાઇની મિલકત શ્રીમતી વસ્ત્રીદાંબને હાવસ્થામભાઇ ખંત જે જી	
		(જામીનાદર-ન), કી વિભય મેળોભવા મેતુરિયા જેથી મહેલમાં પ્રાથ (જામીનાદર-ન) 	૧૫-૦૧-૨૦૨૪ ૨. માંગાણ લોટીસ મુજબ દાધાળી રકમ: ગ્રૂ. ૪૫-૫૮૪૦/- (શ્રીસા ચાર લાખ પંચાણું હત્તર આઠસો વીસ પૂરા) ૧૦-૦૧-૨૦૨૪ મુજબ લાતા ૧૧-૦૧-૨૦૨૪ લી લાગુ સરત ત્યાર, આકરિયક ખર્ચ, કોસ્ટ, ચાર્જ વચ્ચેર. ૧. માંગાણ લોટીસની લાદીખ : ૨૩-૦૫-૨૦૨૪ ૨. માંગાણ લોટીસ મુજબ દાલાળી રકમ: ગ્રૂ.	પહીલા તામે રહેત તહીરા નં ઘટ, ગામ-લામ પ્રમા. તાલું કો-રહેગમ, વિદો-વહારા કી, (ગુજરાત) ખાતેની ભેનિનલ તમામ ભાગ અને દિરસા. હોંગ્યું આપના આ સ્ત્રાહે. ત્રાંગું કોંગું કાંગું કાંગું કોંગું કોંગું કોંગું કોંગું રોડ, ઉત્તર : કાંગું કાંગું કોંગું કોંગું કોંગું કોંગું ગુજનાનામાંની પ્રિલંગ, પશ્ચિમ : ગુજનાનામાંની પ્રત્યો કર્યો કાંગું કોંગું કોંગું કોંગું કોંગું ગુજનાનામાંની પ્રત્યો કર્યો કોંગું કોંગું કોંગું કોંગું કોંગું શ્રાન્યો ભાગો કોંગું કોંગું કોંગું કોંગું કોંગું કોંગું કોંગું કોંગું શ્રાન્યો કાંગું કોંગું કોંગુ કોંગુ કોંગુ કોંગુ કોંગુ કોંગુ કોંગુ કો	
		(જમીનાદર-ન), ક્રી વિભય મંભીભવા મેહિયા જેમી અભેભવાના પુત્ર (જમીનાદર-ર) મેહિલા જેમાં અભેભવાના પુત્ર મેહિલા જેમાં અભેભવાના પુત્ર સોમલી પ્રકૃતિન દેશમુખ જેશી અલ્દેદિતભામ વ્યવસ્થાના દેશમુખ જે ક્રી અલ્દેદિતભામ પુત્ર (સ્વિટ-દ્વાદર), ક્રી દિરેન્દ્રનું માર્ટ ભર્મનામાં દેશમુખ જે ક્રી ઉદ્દેશનામાં પુત્ર (સ્વિટ-દ્વાદર), ક્રી દિરેન્દ્રનું માર્ટ પ્રકૃતનામાં ક્રયાનામાં દરમાં અભ્યાના પ્રકૃતનામાં પ્રકૃતિ માર્ટ પ્રકૃતનામાં પુત્ર (જમીનાદર) માર્ટ (જ્લાઇ) સ્વર્ણ પ્રકૃતિ પ્રકૃતિનાદર) સ્વર્થનામાં પ્રકૃત વાર્ચમાં પુત્ર (સ્વાદર), ક્રી સંતિવ્યુન્સામાં પ્રતામ પુત્ર (દિવાદર),	૧૧-૦૧-૨૦૨૪ ૨. મંગાવાલ નીઠમ મુજલ દાલાની ૨૭+ રૂ. સ. ૧૯૫૮-૨૦ - (ફ્રીયેસ ઘાર લાખ પંચાલું હજાર આદરની વીધ પૂરો ૧૦ -૦૧-૦૨૩ મુજલ વાતા ૧૧ -૦૧-૦૨૭ સારે લાગુ કદત લાગ, આદર્શિયા ખર્ચ, કેસ્ટર, સાર્ય વ્યવેટે. ૧. મંગાવાલ નીટીસ ની લાગ્રેલ પ ૨. મંગાવાલ નીટીસ મુજલ દાલાની ૨૭+ રૂ. ૨. મંગાવાલ નીટીસ મુજલ દાલાની ૨૭+ રૂ.	પહોંચા નાપી રહેલ લીકર નં ૧.૮૮, ગામ-લાખ પૂમા. લાલું લે-રહ્યમ, વિલો નન્સાસી, (ગુજરાત) ખાતેની જેમીનના લામા ભાગ અને હિસ્સા. હેમલન આવશે ઉપલબ્ધ અર્થ અર્થ અર્થ કર્યું હોય કર્યું કર્યું માના માર્ચ કર્યું હોય કર્યું કર્યું કર્યું કર્યું કર્યું કર્યું કર્યું કર્યા પૂર્વ : સુમનનામાની વિલકત, પશ્ચિમ : સ્ટ્રેક, ઉપલ : લાભ્યાની વિલકત, પશ્ચિમ : સ્ટ્રેમના માર્ચની વિલક્ત ના સ્ટ્રેમના પાર્ચ અર્થ અર્થ સ્ટ્રેમના પ્રત્ય કર્યો કર્યા કર્યું કર્યું કર્યું કર્યું કર્યા કર્યું કર	
		(જામીનાદર-ન), કરી લિખા મંભીભવા મેફિલિય જેમી મહેલમાં પણ (જામીનાદર-ન) 14,000,000,000 (427 કોંપ્સદી પણ લેખો કરો કોંપ્સદી પણ લેખો કરો કોંપ્સદી પણ લેખો કરો કોંપ્સદી પણ લેખો કરો કોંપ્સદુ કાંપ્સદી હતું કાંપ્સદુ કરો કોંપ્સદુ કાંપ્સદી હતું કાંપ્સદુ કરો કોંપ્સદુ કાંપ્સદી હતું કાંપ્સદુ કરો કોંપ્સદુ કાંપ્સદી હતું કાંપ્સદુ કરો કોંપ્સદુ કાંપ્સદી હતું કરો કોંપ્સદુ કાંપ્સદી હતું કરો કોંપ્સદુ કાંપ્સદુ કાંપ્સદુ કરો કોંપ્સદુ કાંપ્સદુ કરો કોંપ્સદુ કરો કોંપ્સદુ કરો કોંપસા કાંપસા કાંપસા કરો કોંપસા કરો કોંપસા કાંપસા કરો કોંપસા કરો ક	૧૫-૦૧-૦૨૪ ૧-૫-ંગાલ મોટી સ્મૃત્ય દાલાની ૨૭મ રૂ. ૧૯૫૮-૦૦' (રૂપિયા ચાર લાખ પોલાલું હુંભર આઠલી લીધ પૂર) ૧૦-૦૧-૦૨૦૧ મુખ વાલ ૧૧-૦૧-૦૨૦૧ લીધ લાગુ સદ લાગ, આકર્લિમક ખર્સ, કોસ્ટ, સાર્પ વાગેરે. ૧. માંગાલ મોટીસની લાદીખ : ૨. માંગાલ મોટીસની મુખલ દાલાની ૨૭મ રૂ. ૧. માંગાલ મોટીસ મુખલ દાલાની ૨૭મ રૂ. ૧. પબ્લ્ટ આડને (રૂપિયા ચાલ અને આપ્સાનીલ ભાજ દાલાની લીધ પુષ્પલ દાલાની ૨૭મ રૂ.	પહોલા નાંધો રહેત હોંદર ને . ૧૩૮, ગમ-દામા પૂમા, લાકુલી-ગેન્ડમાં, જિલ્લા-વાર્કાણ, જિલ્લા (ગુજરાત) ખાતેની જમીલના તામમ ભાગ અને હિસ્સા, તેમેક્લા આવતાં સ્થારના આ તે હતે. તાફિલા: પૂર્વ મુંત્રના આ તે કાર્યું કર્યા કર્યું કર્યું એક, વિતર : કાંગ્રુકમાની મિલકત, હોંચા : ગુજરાતાના મિલકત, હોંચા : ગુજરાતાના મિલકત, હોંચા : ગુજરાતાના મિલકત, હોંચા : બુલ્લાના મિલકત, હોંચા : બુલ્લાના મિલકત, હોંચા : બુલ્લાના મિલકત, હોંચા : ગુજના નાંધો રહેલ સ્વિત ને . ૭૦૦(એ, તોફાં ગ્રુકના નાંધો રહેલ સ્વિત ને . ૭૦૦(એ, તોફાં ગ્રાફ, ગુજના નાંધો રહેલ સ્વિત ને . ૭૦૦(એ, તોફાં ગ્રાફ, ગુજના અને રહેલ સ્વિત ને . ૭૦૦(એ, તોફાં ગ્રાફ, ગુજના નાંધો રહેલ સ્વિત ને . ૭૦૦(એ, તોફાં ગ્રાફ, (ગુજના) અલેલા ને બીલના લાખા લાગ્ય	
		(જમીનાદર-ન), ક્રી વિભય મંભીભવા મેહિયા જેમી અભેભવાના પુત્ર (જમીનાદર-ર) મેહિલા જેમાં અભેભવાના પુત્ર મેહિલા જેમાં અભેભવાના પુત્ર સોમલી પ્રકૃતિન દેશમુખ જેશી અલ્દેદિતભામ વ્યવસ્થાના દેશમુખ જે ક્રી અલ્દેદિતભામ પુત્ર (સ્વિટ-દ્વાદર), ક્રી દિરેન્દ્રનું માર્ટ ભર્મનામાં દેશમુખ જે ક્રી ઉદ્દેશનામાં પુત્ર (સ્વિટ-દ્વાદર), ક્રી દિરેન્દ્રનું માર્ટ પ્રકૃતનામાં ક્રયાનામાં દરમાં અભ્યાના પ્રકૃતનામાં પ્રકૃતિ માર્ટ પ્રકૃતનામાં પુત્ર (જમીનાદર) માર્ટ (જ્લાઇ) સ્વર્ણ પ્રકૃતિ પ્રકૃતિનાદર) સ્વર્થનામાં પ્રકૃત વાર્ચમાં પુત્ર (સ્વાદર), ક્રી સંતિવ્યુન્સામાં પ્રતામ પુત્ર (દિવાદર),	૧૧-૦૧-૨૦૨૪ ૨. મંગાવાલ નીઠમ મુજલ દાલાની ૨૭+ રૂ. સ. ૧૯૫૮-૨૦ - (ફ્રીયેસ ઘાર લાખ પંચાલું હજાર આદરની વીધ પૂરો ૧૦ -૦૧-૦૨૩ મુજલ વાતા ૧૧ -૦૧-૦૨૭ સારે લાગુ કદત લાગ, આદર્શિયા ખર્ચ, કેસ્ટર, સાર્ય વ્યવેટે. ૧. મંગાવાલ નીટીસ ની લાગ્રેલ પ ૨. મંગાવાલ નીટીસ મુજલ દાલાની ૨૭+ રૂ. ૨. મંગાવાલ નીટીસ મુજલ દાલાની ૨૭+ રૂ.	પહોંચા નાપી રહેલ લીકર નં ૧.૮૮, ગામ-લાખ પૂમા. લાલું લે-રહ્યમ, વિલો નન્સાસી, (ગુજરાત) ખાતેની જેમીનના લામા ભાગ અને હિસ્સા. હેમલન આવશે ઉપલબ્ધ અર્થ અર્થ અર્થ કર્યું હોય કર્યું કર્યું માના માર્ચ કર્યું હોય કર્યું કર્યું કર્યું કર્યું કર્યું કર્યું કર્યું કર્યા પૂર્વ : સુમનનામાની વિલકત, પશ્ચિમ : સ્ટ્રેક, ઉપલ : લાભ્યાની વિલકત, પશ્ચિમ : સ્ટ્રેમના માર્ચની વિલક્ત ના સ્ટ્રેમના પાર્ચ અર્થ અર્થ સ્ટ્રેમના પ્રત્ય કર્યો કર્યા કર્યું કર્યું કર્યું કર્યું કર્યા કર્યું કર	

અધિકૃત અધિકારી એસઆરજી હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ

# home First Finance Company CIN: L65990MH2010PLC240703 Website: Phone No.: 180030008425 Email ID: loanfirst@hon

- LEII ર ો - LEII ર ો પાટીલ સુનંદાબેનની મિલકત સરનામું કહેટ નં. ૩૦૪, બ્લોક નાં.ઇ, ઋષિ ૫, ટાઉન પ્લાગિંગ સ્ક્રીમ નં. ૪૦, (લેબાસત કિંડોળી, ઓ.પી. નં. ૫૦, ફાઇનલ પ્લ ૫, કાઇના પાર્થિંગ સ્ક્રીમ નં. ૪૦, (લેબાસત કિંડોળી, ઓ.પી. નં. ૫૦, ફાઇનલ પ્લ ૫, કાઇના પાર્થિંગ કે જ્યાં કે જ્યાં કે

द्वीम लं. 2015 श्री-लंदी — 25 वित्त संस्थात मार्च वित्त संस्थात मार्च त्रीमा स्थापन हैं कि प्रतिकृति के स्थापन के प्रतिकृति के स्थापन के स्थापन के स्थापन के के प्रतिकृति के स्थापन के स्थापन के स्थापन के स्थापन के के स्थापन के स्थापन के स्थापन के स्थापन के स्थापन के स्थापन के के स्थापन के स्था

મુશરી કુમાર ઠાકુ

# *captain*

CAPTAIN PIPES LTD

### NOTICE

Pursuant to regulation 29 of the SEBI LODR Regulations 2015 SEB LODR Regulations 2015
Notice is hereby given that the
meeting of board of directors of
the company will be held on
Wednesday, 24th JULY, 2024.

To consider and approve the
unaudited financial results for
the quarter and the year ended
on 30th burg 2024.

on 30 th June, 2024

The said notice can be accesse The said notice can be accessed on the website of the company at www.captainpipes.com and may also be accessed on the stock exchange website at www.bseindia.com.
Place: Raikot

For, Captain Pipes Ltd sd/ Gopal Khichadia (Managing Director)

# FEDBANK સ્કાર્યન લાગ્સ્ટલાં સર્વિસિઝ લીમીટેડ સ્કાર્યન બોલા : યુનિટ નં. ૧૧૦૧, ૧૧મો માળ, સિગન્સ, પ્લીટ નં. ૭૧એ, પાલ, પાસપોલી, મુંબદ-૧૦૦૦૮૭

કબજા નોટીસ

भारती हैं है की इस्तर्भाविक्त सिर्देशियां के स्थाप के स्

(સિક્લોરીટી ઇલ્ટરેસ્ટ એલ્ફોર્સમેલ્ટ નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૧) સાલે વંચાતા પરિશિષ્ટ ૪ મુજ 

ડિઝક્ટ્રુલીટમાં મહુંસ્ટર/માંવાઇતાદર જ્યાર પારુ હવે. પહેલો કે. પાર કરીને દોશારો અને જાહેર જનાતાનો વિલાકત શારો સોદી ન કરવા સાવાદ કરવામાં આવે. તે મિલકત સાહેનો હોલ્પાર સોદો ટાટક કેરિકાટ હાલિસિંગ ફાંટલાનાન્સ લીગીરેકની નોકે જાાવદે અત્ર તેમ જાહેર તેના પારના લાગ અને મોનફાલા નોટીસની લાગેલાથી પેનલ લાગુ, કાર્ય, કોર્સ્ટ અને પેસ્ટે વિલાક રહેલી. વિકાસી એક્સ્ટ પરસે તોલાવા માટે એક્ટની કલા ૧૩ નો પેટા કલામ (૮) ન ગાલાકાઓ પ્રત્યે દેવાદારીનું દચાના દીરવામાં આવે છે.

ĺ	લોન એકા.	દેવાદાર(શે)/કાનુની વારસદાર(શે)/ કાનુની પ્રતિનિધિ(ઓ) ના નામ	માંગણા નોટીસની ૨૭મ	માંગણ નોટીસની તારીપ	ચોર્કસ્ત્રી તારીલ
ı	નંબર			ભૌતિક કબજાની તારીખ	કેસ નંબર
Ī	9900615 & 10685345 &	શ્રી નિરવ દિનેશસંદ્ર પટેલ (દેવાદાર) શ્રીમતી અલ્પાબેન	३।. ९०५५६८८८ /	04/02/2028	40/05/5058
١	10270907 & TCHHF06420	દવાદાર) શ્રામતા અલ્પાબન નિરવકુમાર પટેલ અને શ્રીમતી તનમતીબેન	31. ceccec /-	43-00-	CRMAJ/
l	00100067322	દિનેશચંદ્ર પટેલ (સલ- દેવાદાર)	રૂા. ૧૦૫૨૩૪૦ /-		251/2024
1	C . M . M		V	V 0.0 Y	

સહી/- અધિકૃત અધિકારી ટાટા કેપિટલ ઢાઉસિંગ ફાયળાન્સ લીમીટેડ વતી